

ગુજરાત રાજ્યના શિક્ષણવિભાગના પત્ર-કમાંક
મશબ/1211/414/છ, તા. 11-4-2011 - થી મંજૂર

રસાયણવિજ્ઞાન

ધોરણ 11

(સિમેસ્ટર I)



પ્રતિકાળિત પત્ર

ભારત મારો દેશ છે.
બધાં ભારતીયો મારાં ભાઈબહેન છે.
હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને
વૈવિધ્યપૂર્વી વારસાનો મને ગર્વ છે.
હું સદાચ તેને લાયક બનયા પ્રયત્ન કરીશ.
હું મારાં માત્રાપિતા, શિક્ષકો અને વરીલો પ્રત્યે આદર રાખીશ
અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ.
હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું.
તેમનાં કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે.

કિંમત : ₹ 39.00



ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ
'વિદ્યાયન', સેક્ટર 10-એ, ગાંધીનગર-382 010

© ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર

આ પાઠ્યપુસ્તકના સર્વ હક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળને હસ્તક છે.
આ પાઠ્યપુસ્તકનો કોઈ પણ ભાગ કોઈ પણ રૂપમાં ગુજરાત રાજ્ય શાળા
પાઠ્યપુસ્તક મંડળના નિયામકની લેખિત પરવાનગી વગર પ્રકાશિત કરી શકાશે નહિ.

લેખન

ડૉ. આઈ. એમ. ભંડુ (કન્વીનર)

શ્રી જે. પી. દવે

ડૉ. મધૂર સી. શાહ

ડૉ. જાગૃતિબહેન પટેલ

શ્રીમતી શોભનાબહેન એમ. ટક્કર

શ્રી સી. આઈ. પટેલ

અનુવાદક

ડૉ. આઈ. એમ. ભંડુ (કન્વીનર)

શ્રી જે. પી. દવે

ડૉ. મધૂર સી. શાહ

ડૉ. જાગૃતિબહેન પટેલ

શ્રીમતી શોભનાબહેન એમ. ટક્કર

શ્રી સી. આઈ. પટેલ

સમીક્ષા

શ્રી ડી. એમ. ઘારે

શ્રી એ. આઈ. પટેલ

શ્રી વી. આર. પટેલ

શ્રી એચ. એમ. પટેલ

શ્રી એ. એસ. પટેલ

શ્રી આઈ. એચ. કુરેશી

શ્રી પી. એસ. પટેલ

શ્રી વાય. જે. દવે

શ્રી બી. એ. નાયક

શ્રી એચ. બી. ગાંભી

ભાષાશુદ્ધિ

ડૉ. સુશીલાબહેન એમ. પટેલ

ચિત્રાંકન

શ્રી જી. વી. મેવાડા

સંયોજન

શ્રી ચિરાગ એચ. પટેલ

(વિષય-સંયોજક : ભौતિકવિજ્ઞાન)

નિર્માણ-આયોજન

શ્રી સી.ડી. પંડ્યા

(નાયબ નિયામક : શૈક્ષણિક)

મુદ્રણ-આયોજન

શ્રી હરેશ એસ. લીભાચીયા

(નાયબ નિયામક : ઉત્પાદન)

પ્રસ્તાવના

કોર-કર્ચિક્યુલમ અને એન.સી.ઇ.આર.ટી. દ્વારા
એન.સી.એફ.2005 મુજબ તૈયાર કરવામાં આવેલા નવા
રાખ્રીય અભ્યાસક્રમોના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નવા
અભ્યાસક્રમો તૈયાર કર્યા છે. આ અભ્યાસક્રમો ગુજરાત
સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા મંજૂર થયેલા ધોરણા 11
(સિમેસ્ટર I)ના રસાયણવિજ્ઞાન વિષયના નવા
અભ્યાસક્રમ અનુસાર તૈયાર કરવામાં આવેલું આ
પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓ સમક્ષ મૂક્તાં મંડળ આનંદ
અનુભવે છે.

આ પાઠ્યપુસ્તક પ્રસિદ્ધ કરતાં પહેલાં એની
હસ્તપત્રની આ સ્તરે શિક્ષણકાર્ય કરતા શિક્ષકો અને
તજ્જ્ઞો દ્વારા સર્વાંગી સમીક્ષા કરાવવામાં આવી છે અને
તેમનાં સૂચનો અનુસાર હસ્તપત્રમાં યોગ્ય સુધારાવધારા
કર્યા પછી આ પાઠ્યપુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ મૂળ અંગ્રેજીમાં લખાયેલ પાઠ્યપુસ્તકનો
ગુજરાતી અનુવાદ છે. ગુજરાતી અનુવાદની વિષય અને
ભાષાના નિષ્ણાતો દ્વારા સમીક્ષા કરાવવામાં આવી છે.

પ્રસ્તુત પાઠ્યપુસ્તકને વિષયવસ્તુલક્ષી, રસપ્રદ અને
ક્ષતિરહિત બનાવવા માટે મંડળે પૂરતી કાળજી લીધી છે.
તેમ છતાં શિક્ષણમાં રસ ધરાવનાર વક્તિઓ પાસેથી
પુસ્તકની ગુણવત્તા વધારે તેવાં સૂચનો આવકાર્ય છે.

એચ.કે.પટેલ GAS

નિયામક

તા. 20-10-2013

ડૉ. નીતિન પેથાણી

કાર્યવાહક પ્રમુખ

ગાંધીનગર

પ્રથમ આવૃત્તિ : 2011, પુનર્મુદ્રણ : 2011, 2012, 2013

પ્રકાશક : ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, 'વિદ્યાયન', સેક્ટર 10-એ, ગાંધીનગર વતી

એચ.કે.પટેલ, નિયામક

મુદ્રક :

મૂળભૂત ફરજો

ભારતના દરેક નાગરિકની ફરજ નીચે પ્રમાણે રહેશે :*

- (ક) સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાખ્રોધજનો અને રાજ્યગીતનો આદર કરવાની;
- (ખ) આજાદી માટેની આપણી રાખ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની;
- (ગ) ભારતનાં સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની;
- (ઘ) દેશનું રક્ષણ કરવાની અને રાખ્રીય સેવા બજાવવાની હાકલ થતાં, તેમ કરવાની;
- (ય) ધાર્મિક, ભાષાકીય, ગ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને, ભારતના તમામ લોકોમાં સુભેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજ દેવાની;
- (ય) આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજ તે જાળવી રાખવાની;
- (જ) જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકૂળ રાખવાની;
- (ઝ) વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની;
- (ટ) જાહેર ભિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની;
- (ઠ) રાજ્ય પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્ત સોયાનો ભણી સતત પ્રગતિ કરતું રહે એ માટે, વૈયક્તિક અને સામૂહિક પ્રવૃત્તિનાં તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હંસલ કરવાનો પ્રયત્ન કરવાની.

* ભારતનું સંવિધાન : કલમ 51-ક

અનુકૂળણિકા

1.	રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ	1-14
2.	પરમાણુવીય બંધારણ	15-30
3.	તત્ત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા	31-48
4.	રેડોન પ્રક્રિયાઓ	49-61
5.	હાઇડ્રોજન	62-73
6.	ક્ષ-વિભાગનાં તત્ત્વો (આલ્કલી અને આલ્કલોઈન અર્થ તત્ત્વો)	74-90
7.	કાર્બનિક રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો	91-109
●	પરિશીલન	110-116
	<ul style="list-style-type: none"> ● તત્ત્વના પરમાણુવીય-ક્રમાંક અને મોલ્યર દળ ● તત્ત્વની ઇલેક્ટ્રોનીય રેચના ● ભૌતિક અચળાંકો ● કેટલાક ઉપયોગી રૂપાંતર ગુણક ● 21મી સદીના નોબોલ પારિતોષિક વિજેતા (રસાયણ વિજ્ઞાન) 	